

માર્ચ 7, 2019

બ્રામ્પટનના સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં (પ્રખ્યાત રમતવીરોની ટ્રોફીઓ દર્શાવતા હોલમાં) પાંચ નવા સભ્યોનો સમાવેશ થશે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – બ્રામ્પટન ઘણાં ઉદ્યોગોમાં પ્રતિભાશાળી વ્યક્તિઓથી ભરપૂર છે, અને હવે, પાંચ શ્રેષ્ઠ બ્રામ્પટનવાસીઓ આપણાં શહેરમાં રમતો માટે પોતે આપેલા ફાળા બદલ સન્માન પામવાને યોગ્ય બન્યા છે.

આ વર્ષે, આ પાંચ વ્યક્તિઓને બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં સમાવવામાં આવશે:

- બ્રામ્પટન માર્શનર બેઝબોલ ઈન્કોર્પોરેટેડ સાથે વિતાવેલા 23 વર્ષ સહિત, બ્રામ્પટનમાં બેઝબોલ સમુદાયને પોતાના સમર્પણ બદલ *બિલ્ડર (બોડી બિલ્ડર - પડતલ સ્નાયુબદ્ધ વ્યક્તિની)* શ્રેણીમાં, **ડેવ ડોહર્ટી (Dave Doherty)** ને સમાવવામાં આવશે.
- સગવડોની જોગવાઈ માટે વકાલત કરવી અને સંખ્યાબંધ જુવાનો અને પુખ્ત ઉંમરના સામુદાયિક રમતોના સમૂહને એક સલાહકાર તરીકે પોતાની સહાયતા કરવી સહિત, **ડોન ડોઆન (Don Doan)** ને પણ, એક *બિલ્ડર* તરીકે આપણાં શહેરમાં રમતોના સમુદાયને ફેલાવવામાં તેમણે આપેલા ફાળા બદલ સમાવવામાં આવશે.
- *એથલીટ* શ્રેણીમાં, **માઈકલ હાસેન (Michael Hasen)** ને એક લેકોસ ખેલાડી અને કોચ તરીકે પોતાની સફળતા બદલ બિરદાવવામાં આવશે.
- **માઈકલ મીક્સ (Michael Meeks)** બાસ્કેટબોલમાં પોતાની સફળતાને બિરદાવવા હોલ ઓફ ફેમમાં એક *એથલીટ* તરીકે જોડાશે.
- **રોબી ટેલર (Robbie Taylor)** પણ સ્વીમિંગમાં પોતાની ઉપલબ્ધિઓ માટે *એથલીટ* શ્રેણીમાં ઓળખ મેળવશે.

39^{મી} એન્યુઅલ બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ ઈન્ડક્શન સેરેમની (સમાવેશ સમારંભ) મંગળવાર, મે 14 નાં રોજ રોજ થિયેટર, બ્રામ્પટનમાં યોજાશે. કોકટેલ ડિનર સાંજે 6 વાગ્યે શરૂ થશે, જેના પછી ઈન્ડક્શન સેરેમની અને રિસેપ્શન (સત્કાર સમારંભ) યોજવામાં આવશે. આ વર્ષના મુખ્ય વક્તા ઈવાન્કા ઓસ્માક (Evanka Osmak) છે, જેઓ સ્પોર્ટ્સનેટ સેન્ટ્રલના કો-એન્કર છે.

ટિકિટો હવે વેચાણ માટે રોજ થિયેટર બોક્સ ઓફિસ પરથી ટિકિટ દીઠ \$55 નાં દરે ઉપલબ્ધ છે. 12 વર્ષ અને ઓછી ઉંમરના બાળકો માટે ટિકિટનો દર \$27.50 છે, અને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ મફતમાં આપવામાં આવે છે. તમારી ટિકિટો ખરીદવા, વેબસાઈટ www.rosetheatre.ca જુઓ અથવા 905.874.2800 નંબર પર ફોન કોલ કરો.

બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ અને આ વર્ષે સામેલ થનારા સભ્યો વિશે વધુ માહિતી મેળવવા, બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમની વેબસાઈટ www.brampton.ca/bshf જુઓ.

શું તમે આપણાં શહેરમાં રમતગમતમાં ઉત્કૃષ્ટ ફાળો આપનાર કોઈ વ્યક્તિથી માહિતગાર છો? [વર્ષ 2020 માટેનું નોમિનેશન ફોર્મ ડાઉનલોડ કરો!](#) નામાંકનો જૂન 15, 2019 સુધીમાં સ્વીકારવામાં આવશે.

બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમની સ્થાપના વર્ષ 1979 માં સીટી ઓફ બ્રામ્પટન સાથે સંયુક્તપણે રમતો માટે ઉત્સાહિતોના એક સમર્પિત સમૂહ દ્વારા કરવામાં આવી હતી. તે સીએએ સેન્ટરમાં (CAA Centre) 7575 કેનેડી રોડ - દક્ષિણ (Kennedy Road South) પર સ્થિત છે.

અવતરણો (ક્વોટ્સ):

“કાઉન્સિલ અને બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ સમિતિ વતી, આ વર્ષે સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમમાં સમાવેશ થનારા રમતવીરોને અભિનંદન! બ્રામ્પટનમાં ઘણી રમતો રમાય છે અને આ રમતવીરો દ્વારા આપણાં સમુદાયને આગળ આવતું જોવું રોમાંચક છે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (*Patrick Brown*)

“બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ સમિતિ વતી, આપણી હોલ ઓફ ફ્રેમમાં વર્ષ 2019 માટે સમાવેલ વ્યક્તિઓની ઘોષણા કરતા મને ફરી એકવાર બેહદ ખુશી થાય છે. આ વર્ષની શ્રેણી ભૂતપૂર્વ પ્રસિદ્ધ રમતવીરોની યાદીમાં ઉમેરો કરશે જ્યારે તેઓ મે મહિનામાં પોતાની પ્રતિષ્ઠા મેળવશે. તમામ નવા રમતવીરોને બ્રામ્પટનમાં રમતોમાં પોતાનો વ્યક્તિગત ફાળો આપવા બદલ અભિનંદન.”

- ડીન મેક્લોડ (*Dean McLeod*), અધ્યક્ષ - બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ કમિટી

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારો છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca